



### બ્રેમ્પટનમાં ઈસ્ટર વીકએન્ડ 2022

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 11, 2022) – આ વર્ષે, ગુડ ફ્રાઈડે શુક્રવાર, એપ્રિલ 15 નાં રોજ આવશે અને ઈસ્ટર મન્ડે સોમવાર, એપ્રિલ 18 નાં રોજ આવશે.

સમુદાયને સહાયરૂપ થવા અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓનું સંચાલન રાખેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ [www.311brampton.ca](http://www.311brampton.ca) જોઈ શકે છે અથવા ઈમેઈલ સરનામું [311@brampton.ca](mailto:311@brampton.ca) પર ઈમેઈલ મોકલી શકે છે. અમે સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલને સંબંધિત કોઈપણ બાબતો માટે 24/7 ઉપલબ્ધ રહીએ છીએ.

#### બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ એપ્રિલ 15 થી 18 સુધી નીચેના સર્વિસ લેવેલ્સમાં સંચાલિત રહેશે.

#### શુક્રવાર, એપ્રિલ 15 (ગુડ ફ્રાઈડે)

રવિવાર / રજાના દિવસના સમયપત્રક મુજબ સંચાલન.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

#### શનિવાર, એપ્રિલ 16

શનિવારના સમયપત્રક મુજબ સંચાલન.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ નિયમિત ક્લાકો દરમિયાન ખુલ્લા રહેશે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

#### રવિવાર, એપ્રિલ 17 (ઈસ્ટર મન્ડે)

રવિવાર / રજાના દિવસના સમયપત્રક મુજબ સંચાલન.

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

#### સોમવાર, એપ્રિલ 18 (ઈસ્ટર મન્ડે)

અઠવાડિક કામકાજ દિવસના નિયમિત સમયપત્રક મુજબ સંચાલન.



ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ નિયમિત કલાકો દરમિયાન ખુલ્લા રહેશે. ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 7 થી સાંજે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બધી બસોમાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ટર્મિનલ્સ પર [પ્રોવિન્સના નિયમનો](#) અનુસાર માસ્ક્સ પહેરવાનું ચાલુ રહેશે. સફાઈ અને સેનિટાઈઝિંગ અમલમાં રહે છે, અને સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજિંદા ધોરણે સાફ કરીને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સર્વિસ અપડેટ્સ માટે વેબસાઈટ [www.bramptontransit.com](http://www.bramptontransit.com) જુઓ અથવા [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને Twitter પર અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

### બ્રેમ્પટન રિક્રિએશન

બ્રેમ્પટન રિક્રિએશન સેન્ટર્સ ઈસ્ટરની લાંબી અઠવાડિક રજાઓ દરમિયાન ઘટાડેલા સમયપત્રક પર સંચાલિત રહેશે. હોલિડે અવર્સ [અહીં](#) ઉપલબ્ધ છે.

### બની એગ્સાઈટમેન્ટ (Bunny EGGScitement)

એપ્રિલમાં વસંતના આગમનને Bunny EGGScitement (બની એગ્સાઈટમેન્ટ) સાથે ઉજવો! આ મફત, કૌટુંબિક-અનુકૂળ પ્રસંગમાં ઈસ્ટર બની, એરબ્રશ ટેટૂ, રમતો અને પ્રવૃત્તિઓ, સ્કેવેન્જર હન્ટ અને ઘરે આનંદ માણવા સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે.

ફન બની એગ્સાઈટમેન્ટ પ્રવૃત્તિઓ પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ [www.brampton.ca/recreation](http://www.brampton.ca/recreation) જુઓ.

### બ્રેમ્પટન લાઈબ્રેરી

બ્રેમ્પટન લાઈબ્રેરીની બધી શાખાઓ એપ્રિલ 15 અને એપ્રિલ 17 નાં રોજ બંધ રહેશે.

અમારી સાથે વેબસાઈટ [www.bramptonlibrary.ca](http://www.bramptonlibrary.ca) પર ઓનલાઈન જોડાઈને ઈ-બૂક્સ અને ઓડિયોબૂક્સ, સ્ટ્રીમ ટેલીવિઝન અને મૂવીસ ઉછીની લો, વિવિધ શ્રેણીના શૈક્ષણિક, રચનાત્મક, અને વ્યાવસાયિક ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ, અને ઘણી વસ્તુઓ સુધી પહોંચ મેળવો.

અમારા [ઈવેન્ટ્સ કેલેન્ડર](#) મારફતે બધી ઉંમરના લોકો અને હિતો માટે વર્ચુઅલ કાર્યક્રમો માટે નોંધણી કરાવો અને [ઈમેઈલથી અમારી અદ્યતન માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો](#).

અમને [Facebook](#), [Twitter](#), [Instagram](#), અને [LinkedIn](#) પર અનુસરો અને iOS અને ગૂગલ પ્લે પર બ્રેમ્પટન લાઈબ્રેરી મોબાઈલ એપ યોક્કસ ડાઉનલોડ કરો. [અમારી એપ વિશે વધુ વિગતો માટે અહીં ક્લિક કરો](#). [અમારા કર્મચારીઓ સાથે લાઈવ ચેટ કરવા, કોઈ પ્રશ્ન પૂછવા, અમારી વેબસાઈટ જુઓ](#).

### બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર એપ્રિલ 15, એપ્રિલ 17 અને એપ્રિલ 18 નાં રોજ બંધ રહેશે. આ શેલ્ટર એપ્રિલ 16 નાં રોજ, માત્ર એપોઈન્ટમેન્ટથી, સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.



એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રોડ પર હોય છે. આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

### ઈસ્ટર વીકએન્ડ માટે પીલ પબ્લિક હેલ્થના રિમાઈન્ડર્સ

આપણાં સમુદાયમાં COVID-19 નું ફેલાવાનું ચાલુ છે ત્યારે, વાઈરસ સામે જાહેર આરોગ્ય ઉપાયો આપણાં શ્રેષ્ઠ બચાવમાં રહે તે યાદ રાખવું મહત્વનું છે. COVID-19 નો ફેલાવો રોકવા કોઈપણ વસ્તુ પોતાની મેળે 100% અસરકારક નથી પણ જાહેર આરોગ્ય ઉપાયોના સ્તરો શ્રેષ્ઠ સંરક્ષણ પૂરું પાડે છે. સંરક્ષણના સ્તરોમાં સામેલ છે:

- રસીકરણ કરાવવું.
- બીમાર હોઈએ ત્યારે ઘરે રહેવું.
- તમારા હાથ વારંવાર ધોવા રહેવું.
- ખાંસી અને છીંક ઢાંકીને યોગ્ય પ્રવસનલક્ષી શિષ્ટાચારનો મહાવરો કરવો.
- જરૂર પડે ત્યારે ઉચ્ચ-ગુણવત્તાના માસ્કનો ઉપયોગ કરવો.

પીલમાં તમારી COVID-19 વેક્સિન મેળવવા બુકિંગ કેવી રીતે અને ક્યાં કરાવવું તે અંગે વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ: [peelregion.ca/coronavirus/vaccine/](https://peelregion.ca/coronavirus/vaccine/).

[ઓન્ટેરિયો સુરક્ષિતપણે રિઓપન કરવાના પ્લાન](#)માંની પ્રોવિન્સની માર્ગરેખાઓ અનુસરીને એકબીજાની સંભાળ લો.

-30-

### મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)